

## Ordinary Gazette Part-I-A / 2002

Issue No.	Date	Department
Issue No.4	24-01-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.5	31-01-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.9	28-02-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.13	28-03-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.22	30-05-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.23	06-06-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.26	27-06-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.27	04-07-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.28	11-07-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.30	25-07-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.34	22-08-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.35	29-08-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.39	26-09-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.44	31-10-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.46	14-11-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.48	28-11-2002	This Gazette may contain multiple departments/offices
Issue No.52	26-12-2002	This Gazette may contain multiple departments/offices



ગુજરાત સરકાર

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY, JANUARY 24, 2002/MAGHA 4, 1923

[ No. 4

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compition.

## PART I--A

## CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV--B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Beroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

## PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

## Notification

Sachivalaya, Gandhinagar, 21st January, 2002.

## GUJARAT PANCHAYATS ACT, 1993.

No. KP/4 of 2002/VBN/312000/919/CH.—In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993) and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Kheralu and District Panchayat, Mehsana the Government of Gujarat, hereby:—

(1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exolusion of the said local areas ;

(2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said schedule.

## SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of the exising village	Local area covered in existing village	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Kheralu	Samoja Sadikpur Juth Gram panchayat	(i) Samoja (Revenue Village) (ii) Sadikpur (Revenue Village)	(1) Sadikpur (Revenue Village)	(1) Samoja (2) Sadikpur	(1) Samoja (Revenue Village) (2) Sadikpur (Revenue Village)

By order and in the name of the Governor of Gujarat,

NIRANJAN JOSHI,  
Joint Secretary to Government.



सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLII]

THURSDAY JANUARY 31, 2002 / MAGHA 11, 1923

[No. 5]

Separate paging given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I--A

### CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part-IV-B under the Gujarat Local Boards, Village Panchayats, Municipal Boroughs, District Municipal, Primary Education and Local Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર

તારીખ ૧-૧૨-૨૦૦૧ થી તારીખ ૩૧-૧૨-૨૦૦૧ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજ્યપત્રનો યાદી

અનુ. નંબર	અસાધારણ રાજ્યપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ-૧-અ				
૧.	૧૭૨	કેવી-૧૭૮-૨૦૦૧-એમએનપી-૧૦૮૯-૧૮૨૭-પી	૧૪-૧૨-૦૧	૧૪-૧૨-૦૧ શ. વિ. શિ. મુ.નિ.વિ
૨.	૧૭૩	કેપી-૧૮૯-ઈએલસી-૧૦૨૦૦૧-૮૫૬-ગ	૧૮-૧૨-૦૧	૧૮-૧૨-૦૧ પં.ગ્રા.મુ.નિ.અને
૩.	૧૭૪	કેપી-૧૮૦-ઈએલસી-૧૦૨૦૦૧-૧૦૧૫-ગ	૧૮-૧૨-૦૧	૧૮-૧૨-૦૧ ગ્રા. વિ. વિ.
૪.	૧૭૫	કેવી-૧૮૧-ઓફ ૨૦૦૧-પરચ-૧૦૨૦૦૧-૫૩૬-એલ.	૨૧-૧૨-૦૧	૨૧-૧૨-૦૧ શ.વિ.શ. મુ.નિ.વિ.
૫.	૧૭૬	કશ-૧૮-નશમ-૨૫૨૦૦૧-૯૯૧-ગ	૨૦-૧૨-૦૧	૨૦-૧૨-૦૧ શિક્ષણ વિભાગ

વી. એચ. લથાણી,  
શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,  
સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.



सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY FEBRUARY 28, 2002/ PHALGUNA 9, 1923

[No.]

Separate paging given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part-IV-B under the Gujarat Local Boards, Village Panchayats, Municipal Boroughs, District Municipal, Primary Education and Local Fund Audit Acts.

Annexure-1 to the Panchayats, Rural Housing and Rural Development Department Order No. VBHN-2001/2899/IC-11/CH, Dated 16-2-2002.

### PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

#### Notification

Sachivalaya, Gandhinagar, 16th February, 2002

#### GUJARAT PANCHAYATS ACT, 1993.

No. KP/24 of 2002-VBHN-2001-2899/IC-11/CH.-In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993) and after consultation with the concerned village Panchayats the Taluka Panchayat, Prantij and the District Panchayat, Sabarkantha the Government of Gujarat hereby :-

(1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas.

(2) specifies the new villages named in column 6 comprising of the local area shown in column 7 of the said schedule.

## SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of the existing village	Local area covered in existing village	Local area excluded from existing village.	Name of the new villages formed after division.	Area covered in new villages
1	2	3	4	5	6	7
1.	Prantij	Bai ni Muvadi Group Gram Panchayat	(1) Bai ni Muvadi (Revenue Village) (2) Mavani Muvadi (Revenue Village) (3) Dhandhvasa (Revenue Village) Taluka Talod	(1) Dhandhvasa (Revenue Village) Taluka Talod	(1) Bai ni Muvadi Group (2) Dhandhvasa	i) Bai ni Muvadi (Revenue Village) ii) Mavani Muvadi (Revenue Village) 2. Dhandhvasa (Revenue Village) Taluka Talod

This notification will come into force immediately after one year from the first meeting of the Bai ni Muvadi Group Gram Panchayat, Taluka Prantij, District Sabarkantha.

This notification is an annexure to the Panchayats, Rural Housing and Rural Development Department Order No. VBHN-2001-2899-IG-11-GH, dated 16-2-2002.

By order and in the name of the Governor of Gujarat,

NIRANJAN JOSHI,

Joint Secretary to Government.

Panchayats, Rural Housing and Rural Development Department.

બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતના  
વિભાજન અંગે.

પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ,

હુકમ ક્રમાંક વભન-૨૦૦૧-૨૮૯૯-આઈસી-૧૧-ચ.

સચિવાલય, ગાંધીનગર, તારીખ ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૦૨.

વંચાણે લીધા :-

૧. આ વિભાગના તારીખ ૧૬મી મે, ૨૦૦૧ના પરિપત્ર ક્રમાંક : પરચ-૨૦૦૦-૨૮૮૮-ચ.

૨. ના. ગુ. હા. દ્વારા ખાસ દિવાની અરજી ક્રમાંક : ૧૧૦૪૫-૨૦૦૧-અન્વયે તારીખ ૨૩મી નવેમ્બર, ૨૦૦૧ના રોજ કરવામાં આવેલ આદેશ.

૩. વિક.ક્રીના તા. ૨૪મી નવેમ્બર, ૨૦૦૧ના પત્ર ક્રમાંક : પંચાયત ગુ-૧-કા.-નં-૮૧૨-ગ્રામ પંચાયત વિભાજન-૦૧.

હુકમ

સંવે ૨૦૦૦ના વર્ષમાં સરકારે (મહેસુલ વિભાગ) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું વિભાજન કરીને નવીન તલોદ તાલુકાની રચના કરેલ હતી. આના પરિણામે પ્રાંતિજ તાલુકાના અમુક ગામોનો સમાવેશ નવીન રચાયેલ તલોદ તાલુકામાં કરવામાં આવેલ. તેમાં બાઈની



મુવાડી જુથ ગ્રામ પંચાયતના ૧ બાઈની મુવાડી (૨) માવાની મુવાડી અને (૩) ધાંધવાસણા મહેસુલી ગામો પૈકી ધાંધવાસણા મહેસુલી ગામને સમાવેશ નવીન રચાયેલ તલોદ તાલુકામાં કરવામાં આવતા, આ પ્રાદેશિક ફેરફારના કારણે ધાંધવાસણા ગામને અલગ ગ્રામ પંચાયત આપવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ ધાંધવાસણા ગામને અલગ ગ્રામ પંચાયત આપવા માટે બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતના વહીવટદારે તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૦૦ના રોજ ઠરાવ કરેલ તાલુકા પંચાયત પ્રાંતિજની તા. ૨૮મી ડીસેમ્બર, ૨૦૦૦ના રોજ ઠરાવ નં.-૧૦ થી બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતનું વિભાજન કરીને ધાંધવાસણા ગામને અલગ પંચાયત આપવા ભલામણદર્શક ઠરાવ કરેલ.

સાબરકાંઠા જિલ્લા પંચાયતની કારોબારી સભાએ તેના તારીખ ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના ઠરાવ નં. ૧૨૪થી બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતનું વિભાજન કરવાનો ભલામણદર્શક ઠરાવ કરેલ.

બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતના વિભાજનની દરખાસ્ત જી. વિ. અ. શ્રીની કચેરીમાં પ્રક્રિયા હેઠળ હતી તે દરમિયાન જે ગ્રામ પંચાયતોની મુદત પુરી થઈ ગયેલ હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં અને બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતનું વિભાજન ન થતા આ ગ્રામ પંચાયતનું વિભાજન ન થાય ત્યાં સુધી તેની ચૂંટણી ન કરવા માટે તારીખ ૨૦મી નવેમ્બર, ૨૦૦૧ના રોજ બાઈની મુવાડી ગામના ગામજનોએ ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરેલ હતી. પરંતુ આ રજૂઆત અંગે કોઈ પ્રત્યુત્તર ન મળતાં બાઈની મુવાડી ગામના શ્રી ભુપતસિંહ ઉમદસિંહ ઝાલા દ્વારા નામ ગુ. હા. માં ખાસ દિવાની અરજી ક્રમાંક ૧૧૦૪૫/૨૦૦૧ દાખલ કરીને બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતનું વિભાજન કરીને ધાંધવાસણા ગામને અલગ પંચાયત આપવા અને બંને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટેની દાદ મંગેલ હતી.

ખાસ દિવાની અરજી ક્રમાંક ૧૧૦૪૫/૨૦૦૧ના સંબંધમાં ના. ગુ. હા. કોર્ટ ચૂંટણી પંચને અને વિ. ક. શ્રીને અરજદારની તારીખ ૨૦મી નવેમ્બર, ૨૦૦૧ની રજૂઆત સંબંધમાં હુકમની કોળી મળ્યાની તારીખથી ૧૫ દિવસમાં વિચારણા કરીને નિયમાનુસારનો હુકમ કરવા આદેશ કરેલ હતો.

નામ. ગુજરાત હાઈકોર્ટનો ઉક્ત હુકમ વિકાસ કમિશનરશ્રીને મળતા તેઓએ તેમના તારીખ ૨૪મી નવેમ્બર, ૨૦૦૧ના પત્રથી સદરહુ હુકમ અને બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતના વિભાજનની દરખાસ્ત મોકલી આપેલ હતી, પરંતુ તારીખ ૨૩મી ડીસેમ્બર, ૨૦૦૧ ના રોજ યોજનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતનો સમાવેશ થઈ ગયેલ હતો અને આ સંદર્ભમાં તારીખ ૨૬મી નવેમ્બર, ૨૦૦૧ના રોજ સંબંધિત કલેક્ટર દ્વારા જહેરનામું બહાર પાડવામાં આવેલ બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ ગઈ છે ત્યારે સરકારના તા. ૧૬મી મે, ૨૦૦૧ના પરિપત્રથી નક્કી થયેલ પોલીસી મુજબ નવી ચૂંટાયેલ પંચાયત અસ્તિત્વમાં આવેથી એક વર્ષ બાદ વિભાજન થઈ શકે. આ વિભાગના તારીખ ૧૬મી મે, ૨૦૦૧ના પરિપત્રથી નવી ચૂંટાયેલ ગ્રામ પંચાયતનું વિભાજન એક વર્ષ બાદ કરવાની નીતિ નામ. ગુ. હા. કોર્ટમાં થયેલ ખાસ દિવાની અરજી ક્રમાંક : ૮૪૬૩/૧૯૯૫માં નામ. કોર્ટ દ્વારા ઓરલ ઓર્ડરમાં કરવામાં આવેલ નિરીક્ષણને ધ્યાને લઈને નક્કી કરવામાં આવેલ જેથી આ સંજોગમાં બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ ૨૬મી ડીસેમ્બર, ૨૦૦૧ના યોજાઈ ગયેલ હોવાથી સરકારના તારીખ ૧૬મી મે, ૨૦૦૧ના પરિપત્રની સૂચના મુજબ બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતનું વિભાજન એક વર્ષ બાદ કરી શકાય તેમ છે. બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતનું વિભાજન આ જ પંચાયતની પ્રથમ સભાના એક વર્ષ બાદ કરવાનો આથી નિર્ણય કરવામાં આવે છે. આ અંગેની નિયત નમૂનામાં ધારાધોરણ મુજબની અધિસૂચના ક્રમાંક : કેપી-૨૪-એફ-૨૦૦૨-વભન-૨૦૦૧-૨૮૯૯-આઈસી-૧૧-ચ તારીખ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૦૨થી બહાર પાડેલ છે જે આ હુકમના પરિશિષ્ટ ૧, તરીકે આ સાથે સામેલ છે. આ અધિસૂચનાનો અમલ તેમાં જણાવ્યા પ્રમાણે બાઈની મુવાડી જુથ ગ્રામ પંચાયતની પ્રથમ સભા મળેથી એક વર્ષ પછી તરત જ અમલમાં આવશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

નિરંજન જોષી,

સંયુક્ત સચિવ,

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

તારીખ : ૧-૧-૨૦૦૨ થી તારીખ : ૩૧-૧-૨૦૦૨ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી.

અનુ. નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ-૧-એ				
૧	૧	કેપી-૧-ઓફ ૨૦૦૨-પીઆરએન-૧૩૯૫-(૨૦૦૧)જ તા. ૩-૧-૨૦૦૨	૩-૧-૦૨	પં.ગ્રા. ગૃ. નિ. અને ગ્રા.વિ.વિ.
૨	૨	કેપી-૩-ઈએલસી-૨૦૦૧-૯૫૧-જ	૧૯-૧-૦૨	"
૩	૩	કેપી-૫-ઈએલસી-૧૦૨૦૦૧-૬૮૮-જ	૨૩/૧/૨૦૦૨ ૨૩-૧-૦૨	"

વી. એચ. લથાણી,

શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,

સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.



સુવર્ણચક્ર

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY, MARCH 28, 2002/CAITRA 7, 1924

[No. 13

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compition.

## PART I--A

## CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV--B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શ્રેયાન વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

તારીખ ૧-૨-૨૦૦૨ થી તા. ૨૮-૨-૨૦૦૨ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી.

અનુ. નંબર	અસાધારણ રાજપત્રના નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિદ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ-૧-એ.				
૧.	૪	કેપી-૬-ઈએલસી-૧૦૨૦૦૧-૧૦૧૫-જી	૧/૨	૧/૨ પ. ગ્રા. ગુ. વિ.
૨.	૫	કેપી-૭-૨૦૦૨-૧૦૮૮-૪૫૮-ડી	૧/૨	૧/૨ પ. ગ્રા. ગુ. વિ.
		"-૮- " ૧૧૮૫-૪૬૬-૧૫૩-ડી		
		"-૯- " પીએસઆર-૧૨૮૮-૧૪૨૬-ડી		
		"-૧૦- " ૧૨૮૪-૭૬૬-૧૦-૩		
૩	૬	"-૧૧ થી ૧૮-પીઆરઆર-૨૦૦૨-૧૧૮૮-૧૮૬૫-૮-૨૫-ડી	૫/૨	૫/૨
૪	૭	"-૧૯-ઈએલસી-૨૦૦૦-૨૩૧૮-(૧)-જી	૬/૨	૬/૨
૫	૮	"-૨૦- " ૧૦૨૦૦૦-૨૩૭૮-(૨)-જી	"	"
૬	૯	કેવી-૧૪ સોફ ૨૦૦૨-એનપીએલ-૪૫૨૦૦૦-૬૧૨૨-મ	૮/૨	૮/૨
૭	૧૦	કેપી-૨૧-ઈએલસી-૧૦૨૦૦૦-૧૩૦૮-જી	"	"
૮	૧૧	કેવી-૧૬ સોફ ૨૦૦૨-એનપીએલ-૪૫૦૨-૭૫૨-મ	૧૧/૨	૧૧/૨
૯	૧૨	કેપી-૨૩ સોફ ૨૦૦૨-ઈએલસી-૧૦૮૭-૮૦૮-જી	૧૩/૨	૧૩/૨
૧૦	૧૩	કેપી-૨૨-ઈએલસી-૧૦૨૦૦૦-૮૦૦-જી	૧૩/૨	૧૩/૨
૧૧	૧૪	કથ-૧૯-નશમ-૧૯૨૦૦૧-૮૬૨-ચ	૧૬/૨	૨૦/૨
૧૨	૧૫	કથ-૨૦-નશમ-૧૫૨૦૦૧-૧૫૩૮-ચ	૧૬/૨	૨૦/૨

વી. એચ. લયાણી,  
શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,  
સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.



સત્યમેવ જયતે

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY,

Vol. XLIII]

THURSDAY, MAY 30, 2002/JYAISTHA 9, 1924

[ No. 22

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

## CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શ્રોયાન વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

તારીખ ૧-૪-૨૦૦૨ થી તા. ૩૦-૪-૨૦૦૨ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી.

અનુ. નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ.	પ્રસિદ્ધિની તારીખ	વિભાગનું નામ.	
૧	૨	૩	૪	૫	
ભાગ-૧-એ.					
૧.	૨૪	કેવી-૩૨-ઓફ ૨૦૦૨-એનપીએલ-૪૫૦૨-૧૫૬૦-મ	૩૦/૩	૩૧/૩	શ. વિ. અને શ. ગૃ. વિ.
૨.	૨૫	કથ-૨૩-નશમ-૨૭-૨૦૦૧-૮૩૫-ચ	૨૭/૩	૪/૪	શિક્ષણ વિભાગ.
૩.	૨૬	કથ-૨૪-નશમ-૧૯-૨૦૦૧-૩૬૨-ચ	૩૦/૩	૪/૪	"
૪.	૨૭	કથ-૨૫-નશમ-૨૨-૨૦૦૧-૧૦૨૧-ચ	૩૦/૩	૪/૪	"
૫.	૨૮	કેવી-૪૪ ઓફ ૨૦૦૨-એનપીએલ-૧૦૮૪-૫૫૫૫-આર	૧૫/૪	૧૫/૪	શ. વિ. અને શ. ગૃ. વિ.
૬.	૨૯	કેવી-૪૭- " " એએમએન-૨૦૨૦૦૦-૭૧૨૨-પી	૧૬/૪	૧૬/૪	"
૭.	૩૦	કેપીએન-૧-એસપીએન-પી-૪	૧૬/૪	૨૩/૪	વિકાસ કમિશનર, ગાંધીનગર.
૮.	૩૧	કેપીએન-૨ " " પી૪	"	૨૩/૪	"
૯.	૩૨	કેવી-૫૧-૨૦૦૨-એનપીએલ-૪૫૦૧-૫૧૨૨-મ	૨૦/૪	૨૯/૪	શ. વિ અને શ. ગૃ. વિ.
૧૦.	૩૩	કેવી-૨૯ ઓફ ૨૦૦૨-પીઆરએન-૧૦૮૭-૬૨૪-(૨૦૦૨)-જે	૩૦/૪	૩૦/૪	પં. ગ્રા. ગૃ. અને ગ્રા. વિ. વિ.

વી. એચ. લલાણી,  
શ્રોયાન વ્યવસ્થાપકશ્રી,  
સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.





# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY JUNE 6, 2002/JYAISTHA 16, 1924

[No. 23

Separate paging given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part-IV-B under the Gujarat Local Boards, Village Panchayats, Municipal [Boroughs, District Municipal, Primary Education and Local Fund Audit Acts.

### PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

#### Notification

Sachivalaya, Gandhinagar, 3rd June, 2002.

#### GUJARAT PANCHAYATS ACT, 1993.

No.KP/35 of 2002-VBN-2002-684-CH.—In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993, (Guj. 18 of 1993) and after consultation with the concerned village Panchayats, the Taluka Panchayats, Lathi and the District Panchayat Amreli, the Government of Gujarat hereby:—

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6 comprising of the local areas shown in column 7 of the said schedule.

## SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of the existing village	Local area covered in existing village	Local area excluded from existing village	Name of the new villages formed after division	Area covered in New villages.
1	2	3	4	5	6	7
1.	Lathi	Ambardi Gram Panchayat	(1) Ambardi Ambardi(Petapara) (1) Sanjay Gandhi Co-society (2) Janta co-opera. Society 1, 2. (3) Joshipara (4) Godadiya nagar 1, 2, 3, & 4	Ambardi (1) Sanjay Gandhi Co-society (2) Janta co-opera. society, 1, 2. (3) Joshipara 4. Godadiya nagar 1, 2, 3, & 4.	(1)Ambardi 1.Narayan-nagar. (Ambardi Petapara)	(1) Ambardi (Revenue Village) 2. Narayanagar (Amabardi para)  1. Sanjay Gandhi Co-society. 2. Janta co-opera. Society 1, 2. 3. Joshipsra 4. Godadiyanagar, 1,2,3 4 (Petapara)

Sachivalaya, Gandhinagar, 3rd June, 2002.

## GUJARAT PANCHAYATS ACT, 1993.

No. KP/37 of 2002-VBN-2001-1570-CH.—In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993) and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Lalpur and the District Panchayat Jamnagar, the Government of Gujarat hereby:—

(1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;

(2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said schedule.

## SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of the existing village	Local area covered in existing village	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new village.
1	2	3	4	5	6	7
1.	Lalpur	Padana Gram Panchayat	1. Padana (Revenue Village) 2. Meghapar (Revenue Village) 3. Navaniya (Petapara)	1. Meghpar (Revenue Village) 2. Navaniya (Petapara)	i. Padana ii. Meghapar (Revenue Village) iii. Navaniya	1. Padana (Revenue Village) 2. Meghapar (Revenue Village) 3. Navaniya (Petapara)

By order and in the name of the Governor of Gujarat,

K H KANOJIYA,  
Deputy Secretary to Government.

Government Central Press, Gandhinagar.



સત્યમેવ જયતે

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII

THURSDAY, JUNE 27, 2002/ASADHA 6, 1924

No. 26

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શ્રીયાન વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર

તારીખ ૧-૫-૨૦૦૨ થી તારીખ ૩૧-૫-૨૦૦૨ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫

#### ભાગ-૧-એ

૧.	૩૪	કેપી-૩૦-૨૦૦૨-ટીપીઆર-૪૬૯૮-૩૩૮-ને	૭/૫/૦૨	૭/૫/૦૨	પં. ગ્રા.મુ. અને ગ્રા.વિ. વિ.
૨.	૩૫	જીપી-૩૧-૩૨-૨૦૦૨-પીઆરઆર-૧૧૯૪-૪૦૭-૯(૩૦)	૧૫/૫/૦૨	૧૫/૫/૦૨	"
૩.	૩૬	કેપી-૩૩-ઈએલસી-૧૦૨૦૦૦-૧૩૦૮-ગ	૨૩/૫/૦૨	૨૩/૫/૦૨	"
૪.	૩૭	કેવી-૬૩-ઓફ ૨૦૦૨-નપલ-૪૫૨૦૦૨-મનો-૮૯-મ	૨૪/૫/૦૨	૨૪/૫/૦૨	શ. વિ. અને શ. ગુ. વિ.
૫.	૩૮	કેપી-૩૪-૨૦૦૨-પસમ-૧૦-૨૦૦૨-૯૬૦-૩	૨૭/૫/૦૨	૨૭/૫/૦૨	"
૬.	૩૯	કેવી-૬૭-૨૦૦૨-એનપીએલ-૪૫૯૪-૪૬૦૯-પાર્ટ-II-મ	૩૧/૫/૦૨	૩૧/૫/૦૨	"

વી. એચ. લ્યાલી,  
શ્રીયાન વ્યવસ્થાપકશ્રી,  
સ. મ. પ્રેસ, ગાંધીનગર.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY, JULY 4, 2002/ASADHA 13, 1924

[No. 27

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

### EDUCATION DEPARTMENT

#### NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 25th June, 2002.

#### BOMBAY PRIMARY EDUCATION ACT, 1947.

No.KSH-31-KHPS-1099/143-CH. - WHEREAS, the draft rules further to amend the Bombay Primary Education Rules, 1949 were published as required by sub-section (3) of section 63 of the Bombay Primary Education Act, 1947 (Bom.LXI of 1947) at pages 32-33 of the Gujarat Government Gazette, Part-I-A Central Section, dated the 13th Sept.2001 under the Government Notification, Education Department No.K/SH/16/KHPSH/1099/1340-CH, dated the 1st Sept.2001 for inviting objections and suggestions from all persons likely to be affected thereby within thirty days from the date of Publication in the **Official Gazette**;

“AND WHEREAS, on objections or suggestions have been received from the public on the said draft notification by the Government;

“NOW, THEREFORE, in exercise of the powers conferred by section 63 of the Bombay Primary Education Act, 1947 (Bom.LXI of 1947), the Government of Gujarat hereby makes the following rules further to amend the Bombay Primary Education Rules, 1949, namely :-

1. These rules may be called the Bombay Primary Education (Gujarat Amendment) Rules, 2002.
2. In the Bombay Primary Education Rules, 1949, in SCHEDULE-F, for the condition 5, the following shall be substituted, namely :-

“5 Closure of school or reduction in the total number of classes :- No management of recognised private primary school shall reduce the total number of classes in its school or close down the school without the prior permission in writing of the Director of Primary Education, State of Gujarat. For this purpose the management shall have to make an application to the authorised Officer atleast six months before the date from which it intends to reduce the number of classes or close down the school. On receipt of such application, the authorised Officer shall hear the management and forward such application with his remarks to the Director

of Primary Education, State of Gujarat. The Director of Primary Education, State of Gujarat may in such manner as may be deemed necessary, make such further inquiry as it may appear to it to be necessary and shall decide whether the application should be granted or refused either in whole or in part."

By order and in the name of the Governor of Gujarat,

**BACHUBHAI NAI**

Under Secretary to Government.

**PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT**

**NOTIFICATION**

Sachivalaya, Gandhinagar, 27th June, 2002.

**GUJARAT PANCHAYATS ACT, 1993.**

No.KP/30 of 2002-VBN/2998/4722/CH :- In exercise of the powers conferred by section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993) and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Anand and the Ode Barough Nagar Palika, Taluka Anand, District Anand the Government of Gujarat hereby :-

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said schedule.

**SCHEDULE**

Sr. No.	Name of Taluka	Name of the existing village	Local area covered in existing village	Local area excluded from existing village	Name of the new villages formed after division	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Anand	Ode Barough Nagar Palika	1) Ode Barough Nagar Palika 2) Kanbhai Pura (Paru)	Ode Barough Nagar Palika 1) Kanbhai Pura (Peta Paru)	1) Kanbhai Pura	1) Kanbhai Pura (Peta Paru)

By order and in the name of the Governor of Gujarat,

**K.H.KANOJIYA,**

Deputy Secretary to Government.

Government Central Press, Gandhinagar.





सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY, JULY 11, 2002/ASADHA 20, 1924

[No. 28

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

## PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

### NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 2nd July, 2002.

### GUJARAT PANCHAYATS ACT, 1993.

No.KP/41 of 2002-VBN/2001/M-95/CH. - In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993) and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Savarkundla and the District Panchayat, Amreli the Government of Gujarat hereby :-

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said schedule.

### SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of the existing village	Local area covered in existing village	Local area excluded from existing village	Name of the new villages formed after division	Area covered in new villages
1	2	3	4	5	6	7
1.	Savar-kundla	Adasang Gram Panchayat	(1) Adasang (2) Ghansh-yamnagar	Adasang (1) Ghansh-yamnagar	(1) Adasang (2) Ghansh-yamnagar	(1) Adasang (Revenue village)

1	2	3	4	5	6	7
						(2) Ghansh- yamnagar Para (Revenue village)

By order and in the name of the Governor of Gujarat,

**K.H.KANOJIA,**  
Deputy Secretary to Government.





सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

VOL. XLIII] THURSDAY, JULY 25, 2002/SRAVANA 3, 1924

[NO. 30]

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I—A

### CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર

તારીખ : ૧-૬-૨૦૦૨ થી ૩૦-૬-૨૦૦૨ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી.

અ. અસાધારણ નં. રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧ ૨	૩	૪	૫

#### ભાગ-૧-અ

૧	૪૦	કેવી-૬૯ ઓફ ૨૦૦૨-નપલ-૪૫૦૨-મનો-૮૯-પાર્ટ-૧-મ	૪/૬	૪/૬	શ. વિ. અને શ. ગૃ. વિ.
૨	૪૧	કેપી-૩૮-ઈએલસી-૨૦૦૨-૧૨૨૨-૪	૧૨/૬	૧૨/૬	પં. ગ્રા. ગૃ. અને ગ્રા. વિ. વિ.
૩	૪૨	કેવી-૭૧-૨૦૦૨-એનપીએલ-૪૫૨૦૦૦-૬૧૨૨-મ		૧૨/૬	શ. વિ. અને શ. ગૃ. વિ.
૪	૪૩	કેવી-૭૨-૨૦૦૨-એએમએન-૨૬૦૨-૧૨૮૫-પી		૧૩/૬	શ. વિ. અને શ. ગૃ. વિ.
૫	૪૪	કેપીએન-૩-એસપીએન-પી-૪	૧૧/૬	૧૭/૬	વિકાસ કમિશનર, ગુ. રા.
૬	૪૫	કેવી-૭૭-૨૦૦૨-એનપીએલ-૪૫૦૨-૨૧૧૭-મ		૧૭/૬	શ. વિ. અને શ. ગૃ. વિ.
૭	૪૬	કેવી-૭૮-૨૦૦૨-નપલ-૪૫૨૦૦૨-મ	૧૮/૬	૧૮/૬	શ. વિ. અને શ. ગૃ. વિ.

વી. એચ. લયાણી,  
શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,  
સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર

©



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII] THURSDAY AUGUST 22, 2002/SRAVANA 31, 1924 [No. 34

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

### PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

#### Notification

Sachivalaya, Gandhinagar, 17th August, 2002

GUJARAT PANCHAYATS ACT, 1993.

No. : KP/52/ of 2002-VBN/2002-M-23/CH :- In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993) and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Anjar and the District Panchayat, Kutchh the Government of Gujarat hereby :-

(1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas ;

(2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said schedule.

#### SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of the existing village.	Local area covered in existing village.	Local area excluded from existing village.	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Anjar	Sapeda Juth Gram Panchayat	(1) Sapeda (Revenue Village)	(1) Bhadroi	(1) Sapeda Group	1. (1) Sapeda (Revenue Village)

I-A-12.



1	2	3	4	5	6	7
		(2) Bhadroi (Revenue Village).		(2) Bhadroi		(i) Rata Talav (Revenue Village)
		(3) Rata Talav (Revenue Village)			2. Bhadroi (Revenue Village).	

By order and in the name of the Governor of Gujarat,

**N. D. PATEL,**

Under Secretary to Government,





# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

VOL : XLIII]

THURSDAY, AUGUST 29, 2002, BHADRA 7, 1924

[NO. 35

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I—A

### CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

તારીખ : ૧-૭-૨૦૦૨ થી તારીખ : ૩૧-૭-૨૦૦૨ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી.

અનુ. નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ-૧-એ				
૧.	૪૭	કેપીએન-૪-એસપીએન-પી-૪, ૨-૭-૦૨	૨-૭-૦૨	વિકાસ કમીશ્નર, ગાંધીનગર.
૨.	૪૮	કેપીએન-૫-એસપીએન-પી-૪, ૨-૭-૦૨	૨-૭-૦૨	વિકાસ કમીશ્નર, ગાંધીનગર.
૩.	૪૯	કેપી-૪૨-ઈએલસી-૧૦૨૦૦૦-૧૩૦૮-જી, ૪-૭-૦૨	૪-૭-૦૨	પં.ગ્રા.ગૃ.નિ.અને ગ્રા.વિ.વિ.
૪.	૫૦	કેવી-૯૦ ઓફ ૨૦૦૨-એનપીએલ-૪૫૯૪-૪૬૦૯- પાર્ટ-૨-મ.	૯-૭-૦૨	શ.વિ. અને શ.ગૃ. જિ. યિ.



૧	૨	૩	૪	૫
૫.	૫૧	કેપી-૪૩-ઈએલસી-૧૦૨૦૦૨-૮૦૦-૭	૧૧-૭-૦૨	પં.ગ્રા.ગૃ.નિ.અને ગ્રા.વિ.વિ.
૬.	૫૨	કેપી-૪૪-૨૦૦૨-પીઆરઆર-૧૧૮૭-૪૦૨-૮૨૪-ડી	૧૧-૭-૦૫	પં.ગ્રા.ગૃ.નિ.અને ગ્રા.વિ.વિ.
૭.	૫૩	કેપીએન-૬-એસપીએન-પી-૪	૧૬-૭-૦૨	વિકાસ કમીશ્નર, ગાંધીનગર.
૮.	૫૪	કેપીએન-૭-એસપીએન-પી-૪	૧૬-૭-૦૨	વિકાસ કમીશ્નર, ગાંધીનગર.
૯.	૫૫	કેપી-૪૫-૨૦૦૨-પીઆરઆર-૧૧૮૪-૪૮૨-૮૬૩-ડી	૨૦-૭-૦૨	પં.ગ્રા.ગૃ.નિ.અને ગ્રા.વિ.વિ.
૧૦.	૫૬	કેવી-૮૭-૨૦૦૨-એનવીએલ-૧૦૦૨-૨૭૮૮-મ.	૨૩-૭-૦૨	શ.વિ. અને શ.ગૃ.નિ.વિ.
૧૧.	૫૭	કેપીએન-૮-એસપીએન-પી-૪	૨૮-૭-૦૨	વિકાસ કમીશ્નર, ગાંધીનગર.
૧૨.	૫૮	કેપીએન-૯-એસપીએન-પી-૪	૨૮-૭-૦૨	વિકાસ કમીશ્નર, ગાંધીનગર.
૧૩.	૫૯	કેપી-૪૬-૨૦૦૨-પીએચબી-૧૦૮૬-૧૮૧૩-ડી	૨૮-૭-૦૨	પં.ગ્રા.ગૃ.નિ.અને ગ્રા.વિ.વિ.

વી.એચ.લયાણી

શ્રેયાન વ્યવસ્થાપકશ્રી

સરકારી મધ્યસ્થ પ્રેસ,

ગાંધીનગર.

સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ
સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ
સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ
સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ
સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ	સરકારી મધ્યસ્થ પ્રેસ



39  
39  
©



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

File

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY, SEPTEMBER 26, 2002/ASVINA 4, 1924 [N0.39

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

### EDUCATION DEPARTMENT

#### Notification

Sachivalaya, Gandhinagar, 16th September, 2002.

#### BOMBAY PRIMARY EDUCATION ACT, 1947.

No. K/SH/34/PRE-1101/2660/K:—The following draft notification which is proposed to be issued under sub-section (1) of section 63 of the Bombay Primary Education Act, 1947 (Bom. LXI of 1947), is published as required by sub-section (3) of the said section 63 for the information of all persons likely to be affected thereby and notice is hereby given that the said draft will be taken into consideration by the Government of Gujarat on or after the expiry of thirty days from the date of publication of this notification in the official Gazette.

2. Any objection or suggestion which may be recieved by the Secretary to Government, Education Department, Sachivalaya, Gandhinagar from any person with respect to the said draft notification before the expiry of the aforesaid period will be considered by the Government.

#### Draft-Notification

No. K/SH/34/PRE-1101/2660/K:—In exercise of the powers conferred by sub-section (1) of section 63 of the Bombay Primary Education Act, 1947 (Bom. LXI of 1947), the Government of Gujarat hereby makes the following rules further to amend the Bombay Primary Education Rules, 1949, namely:—

1. These rules may be called the Bombay Primary Education (Gujarat Amendment) Rules, 2002.

2. In the Bombay Primary Education Rules, 1949, (hereinafter referred to as "the said rules") rule 41 shall be deleted.

3. In the said rules, in rule 63, in sub-rule (2), clause (d) shall be deleted.

By order and in the name of the Governor of Gujarat,

**BACHUBHAI NAI,**  
Under Secretary to Government.

શિક્ષણ વિભાગ

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૦૨.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭.

ક્રમાંક : ક/એસએચ/૩૪-પીઆરઈ/૧૧૦૧-૨૬૬૦-ક:મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સને ૧૯૪૭ના મુંબઈના ૬૧માં) ની કલમ ૬૩ની પેટા-કલમ (૧) હેઠળ કાઢવા ધારેલો જાહેરનામાનો નીચેનો મુસદ્દો સદરહુ કલમ ૬૩ની પેટા કલમ (૩)થી ઠરાવ્યા પ્રમાણે તેનાથી અસર થવાનો સંભવ હોય તેવી તમામ વ્યક્તિઓની જાણ સારૂ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આથી નોટીસ આપવામાં આવે છે કે આ જાહેરનામું રાજ્ય પત્રમાં પ્રસિદ્ધ થયાની તારીખથી ત્રીસ દિવસ પુરા થયે અથવા તે પછી, ગુજરાત સરકાર, સદરહુ મુસદ્દો વિચારણામાં લેશે.

૨. ઉપર્યુક્ત મુદત પૂરી થાય તે પહેલા, સદરહુ જાહેરનામાના મુસદ્દાના સંબંધમાં કોઈપણ વ્યક્તિ તરફથી સરકારના સચિવ, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર-ને જે કોઈ વાંધા અથવા સૂચનો મળશે તે સરકાર વિચારણામાં લેશે.

જાહેરનામાનો મુસદ્દો

ક્રમાંક : ક/એસએચ/૩૪-પીઆરઈ/૧૧૦૧-૨૬૬૦-ક:મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સને ૧૯૪૭ના મુંબઈના ૬૧માં) ની કલમ ૬૩ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૮ વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. આ નિયમો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો (ગુજરાત સુધારો) નિયમો-૨૦૦૨ કહેવાશે.  
૨. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮ (જેનો આમાં હવે પછી "સદરહુ નિયમો" તરીકે ઉલ્લેખ કર્યો છે તે) માં નિયમ-૪૧ કમી કરવો.

૩. સદરહુ નિયમોમાં, નિયમ-૬૩માં, પેટા-નિયમ (૨)માં, ખંડ (ધ) કમી કરવો.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

બચુભાઈ નાથી,

સરકારના ઉપ સચિવ.



## વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

તારીખ ૧-૮-૨૦૦૨ થી તારીખ ૩૧-૮-૨૦૦૨ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુ. નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિદ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
૧	૬૦	કેવી-૧૦૧-૨૦૦૨-વીએમએન-૨૧૯૯-૪૬૯૪-પી તારીખ ૧-૮-૨૦૦૨	તા. ૧-૮-૨૦૦૨	શ.વિ. અને શ. ગૃ. નિ. વિભાગ
૨	૬૧	કપવ-૧૦-૫૬૪-પં. ૪ તા. ૨૫-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૩	૬૨	કપવ-૧૧-૫૬૪-પં. ૪ તા. ૨૬-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૪	૬૩	કપવ-૧૨-૫૬૪-પં. ૪ તા. ૨૬-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૫	૬૪	કપવ-૧૩-૫૬૪-પં. ૪ તા. ૨૬-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૬	૬૫	કપવ-૧૪-૫૬૪-પં. ૪ તા. ૨૬-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૭	૬૬	કપવ-૧૫-૫૬૪-પં. ૪ તા. ૨૬-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૮	૬૭	કપવ-૧૬-૫૬૪-પં. ૪ તા. ૨૬-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૯	૬૮	કપવ-૧૭-૫૬૪-પં. ૪ તા. ૨૬-૭-૨૦૦૨	૫-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૧૦	૬૯	કેપી-૪૭-ઈએલસી-૧૦૨૦૦૨-૮૦૦-જી તા. ૫-૮-૨૦૦૨	૫-૮-૨૦૦૨	પં. ગ્રા. ગૃ.નિ. અને ગ્રા.વિ.વિ.
૧૧	૭૦	કેપી-૪૮-ઈએલસી-૧૦૨૦૦૨-૮૦૦-જી તા. ૫-૮-૨૦૦૨	૫-૮-૨૦૦૨	પં. ગ્રા. ગૃ.નિ. અને ગ્રા.વિ.વિ.
૧૨	૭૧	કેપી-૪૯-ઈએલસી-૧૦૨૦૦૨-૮૦૦-જી તા. ૫-૮-૨૦૦૨	૫-૮-૨૦૦૨	પં. ગ્રા. ગૃ.નિ. અને ગ્રા.વિ.વિ.
૧૩	૭૨	કેપી-૫૦-ઈએલસી-૧૦૨૦૦૨-૮૦૦-જી તા. ૫-૮-૨૦૦૨	૫-૮-૨૦૦૨	પં. ગ્રા. ગૃ.નિ. અને ગ્રા.વિ.વિ.
૧૪	૭૩	કેપી-૫૧-૨૦૦૨-પસમ-૧૦૨૦૦૨-૨૦૮૭-ડ તા. ૭-૮-૨૦૦૨	૭-૮-૨૦૦૨	પં. ગ્રા. ગૃ.નિ. અને ગ્રા.વિ.વિ.
૧૫	૭૪	કેપીએન-૧૮-એસપીએન-પી-૪ તા. ૩-૮-૨૦૦૨	૧૪-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૧૬	૭૫	કેપીએન-૧૯-એસપીએન-પી-૪ તા. ૩-૮-૨૦૦૨	૧૪-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૧૭	૭૬	કેપીએન-૨૦-એસપીએન-પી-૪ તા. ૩-૮-૨૦૦૨	૧૪-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૧૮	૭૭	કેપીએન-૨૧-એસપીએન-પી-૪ તા. ૩-૮-૨૦૦૨	૧૪-૮-૨૦૦૨	વિકાસ કમીશનર ગુ. રા. ગાંધીનગર
૧૯	૭૮	કેપી-૫૩-૨૦૦૨-પીઈઆર-૧૩૮૬-૭૧૬-૧૧-૩-ડી તા. ૨૦-૮-૨૦૦૨	૨૦-૮-૨૦૦૨	પં. ગ્રા. ગૃ.નિ. અને ગ્રા.વિ.વિભાગ
૨૦	૭૯	કેપી-૫૪-૨૦૦૨-પીએસઆર-૧૨૮૪-૫૯૩-૧૦- ૧૬-ડી તા. ૨૦-૮-૨૦૦૨.	૨૦-૮-૨૦૦૨	પં. ગ્રા. ગૃ.નિ. અને ગ્રા.વિ.વિભાગ

વી. એચ. લયાણી,

શ્રેયાન વ્યવસ્થાપક,

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.





सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII] THURSDAY, OCTOBER 31, 2002/KARTIKA 9, 1924 No. 44

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

તારીખ : ૧-૯-૦૨ થી તારીખ ૩૦-૯-૦૨ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અ.નં.	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
૧	૮૦	કેવી-૧૧૮ ઓફ ૨૦૦૨-૫૨૪-૧૦૨૦૦૨-૫૩૬-એલ ૨-૯-૦૨	૨-૯-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ. વિભાગ
૨	૮૧	કેપી-૫૫ -૨૦૦૨-પીઆરઆર-૧૧૯૭-૧૮૧૧-ડી ૨૯-૮-૦૨	૨-૯-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા. વિ. વિભાગ
૩	૮૨	કેવી-૧૨૨ -૨૦૦૨-નપલ-૪૫૨૦૦૦-મનો-૧૮-મ ૩-૯-૦૨	૩-૯-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ. વિભાગ
૪	૮૩	કેપીએન-૨૨-એસપીએન-પી-૪ ૨૬-૯-૦૨	૩-૯-૦૨	વિકાસ કમીશનર, ગાંધીનગર
૫	૮૪	„ -૨૩- „ „ „	„	„ „
૬	૮૫	„ -૨૪- „ „ „	„	„ „
૭	૮૬	„ -૨૫- „ „ „	„	„ „

અ.નં.	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ	
૧	૨	૩	૪	૫	
૮	૮૭	કેપીએન-૨૨-એસપીએન-પી-૪ -૨૬-	૨૬-૯-૦૨	૩-૯-૦૨	વિકાસ કમીશનર, ગાંધીનગર
૯	૮૮	” -૨૭- ” ” ”	”	”	”
૧૦	૮૯	” -૨૮- ” ” ”	”	”	”
૧૧	૯૦	” -૨૯- ” ” ”	”	”	”
૧૨	૯૧	” -૩૦- ” ” ”	”	”	”
૧૩	૯૨	” -૩૧- ” ” ”	”	”	”
૧૪	૯૩	કેપી-૫૬ -ઈએલસી- ૧૦૨૦૦૨-૯૦૦ - ગ	૧૩-૯-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા. વિ. વિભાગ	
૧૫	૯૪	કેવી-૧૨૫ - ઓફ ૨૦૦૨-એમએનએ-૧૦૦૧-સીએમઆર-૪૧ (i)- પી	૧૩-૯-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ. વિભાગ	
૧૬	૯૫	કેવી-૧૨૬ - ઓફ ૨૦૦૨-એમએનએ-૧૦૦૧-સીએમઆર-૪૧ (ii)- પી	૧૩-૯-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ. વિભાગ	
૧૭	૯૬	કેવી-૧૨૭ - ઓફ ૨૦૦૨-એમએનએ-૧૦૦૧-સીએમઆર-૪૧ (iii)- પી	૧૩-૯-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ. વિભાગ	
૧૮	૯૭	કેપી-૫૭ - ૨૦૦૨-પીઆરઆર-૧૦૯૮-૧૭૦૨(૯)-ડી	૧૯-૯-૦૨	પં.ગ્રા.ગૃ.નિ અને ગ્રા.વિ. વિભાગ	

વી. એચ. લક્ષ્મી,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સ.મ.મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII] THURSDAY, NOVEMBER 14, 2002/KARTIKA 23, 1924 [No. 46

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શિક્ષણ વિભાગ

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૫મી જૂન, ૨૦૦૨.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭.

ક્રમાંક : કેએસએચ-૩૧-કેએચપીએસ-૧૦૮૮-૧૪૩-ચ:—મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સને ૧૯૪૭ના મુંબઈના ૬૧મા)ની કલમ ૬૩ની પેટા-કલમ (૩)થી ફરમાવ્યા પ્રમાણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮ વધુ સુધારતા નિયમોનો મુસદ્દો શિક્ષણ વિભાગના તારીખ ૧લી સપ્ટેમ્બર, ૨૦૦૧ના સરકારી જાહેરનામા ક્રમાંક/કે-એસએચ-૧૬-કેએચપીએસએચ-૧૦૮૮-૧૩૪૦-ચ, હેઠળ, તારીખ ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના ગુજરાત સરકારી રાજપત્ર ભાગ-૧ એ, સેન્ટ્રલ સેક્શનના પાના નંબર ૩૨-૩૩ ઉપર પ્રસિદ્ધ કર્યો હતો અને તેનાથી અસર થવાનો સંભવ હોય તે તમામ વ્યક્તિઓ તરફથી, તેની રાજપત્રમાં પ્રસિદ્ધની તારીખથી ત્રીસ દિવસની અંદર વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા;

અને સદરહુ જાહેરનામાના મુસદ્દા અંગે, સરકારને લોકો તરફથી કોઈ વાંધા અથવા સૂચનો મળ્યા નથી;

તેથી, હવે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સને ૧૯૪૭ના મુંબઈના ૬૧મા)ની કલમ ૬૩થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮ વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:—

૧. આ નિયમો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ (ગુજરાત સુધારા) નિયમો, ૨૦૦૨ કહેવાશે.

૨. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮માં, અનુસૂચિ-૯માં શરત નં. પને બદલે નીચેનો મજકૂર મૂકવો :—

“પ. શાળા બંધ કરવા અથવા વર્ગોની કુલ સંખ્યા ઘટાડવા બાબત:—

કોઈપણ માન્ય જ્ઞાનગી પ્રાથમિક શાળાનું સંચાલક મંડળ, પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્યની લેખિત પૂર્વ પરવાનગી સિવાય, તેની શાળાના વર્ગોની કુલ સંખ્યા ઘટાડી શકશે નહિ અથવા શાળા બંધ કરી શકશે નહિ. આ હેતુ માટે, સંચાલક મંડળે જે તારીખથી વર્ગોની સંખ્યા ઘટાડવાનો અથવા શાળા બંધ કરવાનો ઈરાદો ધરાવ્યો હોય તે તારીખથી ઓછામાં ઓછા છ મહિના



પહેલાં અધિકૃત અધિકારીને અરજી કરવી જોઈશે. એવી અરજી મળ્યે, અધિકૃત અધિકારી સંચાલક મંડળને સાંભળશે અને એવી અરજી પોતાની ટીકાટિપ્પણ સાથે પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્યને મોકલી આપશે. પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય તેમને જરૂરી લાગે તેવી રીતે, જરૂરી જણાય તેવી વધુ તપાસ કરીને અરજી પૂર્ણતઃ અથવા અંશતઃ મંજૂર કરવી અથવા નકારવી તેનો નિર્ણય કરશે.”

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

બચુભાઈ નાયી,  
સરકારના ઉપસચિવ.

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII]

THURSDAY, NOVEMBER 28, 2002/AGRAHAYANA 7, 1924 [NO. 48

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર.

તારીખ : ૧-૧૦-૦૨ થી તારીખ ૩૧-૧૦-૦૨ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અ.નં.	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ-૧અ				
૧	૯૮	કેપી-૫૮-૨૦૦૨-પીડીએસ-૧૦૮૮-૧૮૫૯-ગ	૧-૧૦-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા. વિ. વિભાગ
૨	૯૯	કેપી-૫૯-ઈએલસી-૧૦૨૦૦૦-૧૩૦૮-ગ	૮-૧૦-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા.વિ. વિભાગ
૩	૧૦૦	કેવી-૧૪૨ ઓફ ૨૦૦૨-એનપીએલ-૯૫૨૦૦૦-૬૧૨૨-મ	૧૧-૧૦-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ.વિ.
૪	૧૦૧	કેપી-૬૦-ઈએલસી-૧૦૨૦૦૨-૯૦૦-(પાર્ટ-આઈ)-ગ	૧૧-૧૦-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા. વિ. વિભાગ
૫	૧૦૨	કેપી-૬૧-ઈએલસી-૨૦૦૨-૧૨૨૨-ગ	૧૧-૧૦-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા. વિ. વિભાગ
૬	૧૦૩	કેવી-૧૪૩ ઓફ ૨૦૦૨-એએમએન-૨૬૦૨-૧૨૮૫-પી	૧૧-૧૦-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ.વિ.
૭	૧૦૪	કેવી-૧૪૪ ઓફ ૨૦૦૨-એએમએન-૨૦૨૦૦૦-૭૧૨૨-પી	૨૧-૧૦-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ.વિ.
૮	૧૦૫	કેવી-૧૪૯-૨૦૦૨-બીએમએન-૩૧૦૨-૪૭૩૪-પી	૨૪-૧૦-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ.વિ.
૯	૧૦૬	કેવી-૧૫૦ ઓફ ૨૦૦૨-નપલ-૧૧૨૦૦૨-૪૨૩૨-પી	૨૪-૧૦-૦૨	શ. વિ. અને શ.ગૃ.નિ.વિ.
૧૦	૧૦૭	કેપી-૨૦૦૧નો ૧૪૪-પીડીએસ-૧૦૮૯-૪૦૬૭ ૨૨-૧૦-૨૦૦૧	૨૪-૧૦-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા. વિ. વિભાગ
૧૧	૧૦૮	કેપી-૬૨-ઈએલસી-૧૦૨૦૦૨-૯૦૦-પાર્ટ આઈ-ગ ૨૨-૧૦-૨૦૦૧	૨૯-૧૦-૦૨	પં. ગ્રા.ગૃ.નિ. અને ગ્રા. વિ. વિભાગ
૧૨	૧૦૯	કેપીએન-૩૨-એસપીએન-પી-૪	૩૦-૧૦-૦૨	વિકાસ કમિશનર ગાંધીનગર

વી. એચ. લ્યાણી,  
ગ્રેયાન વ્યવસ્થાપક,  
સ.મ.મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLIII] THURSDAY, DECEMBER 26, 2002/PAUSA 5, 1924 [No. 52

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.

તારીખ : ૧-૧૧-૨૦૦૨ થી તારીખ : ૩૦-૧૧-૨૦૦૨ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી.

અનુ. નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિદ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫

### ભાગ-૧-અ

૧	૧૧૦	કશ-૩૬-નશમ-૧૭૦૨-૧૩૬૩-ચ	૧૩-૧૧-૦૨	શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
---	-----	-----------------------	----------	-------------------------------------

વી.એચ.લયાણી,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,  
ગાંધીનગર.